

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૮/૧૦/૨૦૨૧ થી તા.૨૪/૧૦/૨૦૨૧ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્પેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :-

(૧) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૬૨૧૦૯૦૧/૨૦૨૧ IPC ક.૪૫૭, ૩૮૦ મુજબ ફરીયાદી હરીશ પ્રધાનભાઈ બાદરશાહી રહે.ખારવા વાડ દ્વારા ફળીયું રામદેવપીરના મંદિર પાસે “સાંકળી આઈ કુપા” પોરબંદર દ્વારા ફરીયાદ નોંધાવેલ કે, કોઈ અજાણ્યા ચોર ઈસમ પોરબંદર ખારવાવાડ રાંદલ ફળીયામાં આવેલ “મોટા રાંદલ માતા” નાં મંદિરમાં રહેલ રાંદલ માતાજીનું સોનેરી કલરનું ચાંદીનું મુંગટ આશરે ૧૦૦ ગ્રામનું જેની આશરે કિ.રૂ.૩,૫૦૦/- નું ચોરી કરી લઈ ગયેલ હોય જેથી કીર્તિમંદિર પો.સ્ટે.નાં PSI શ્રી બી.એસ.ઝાલા, LR વીશાલ રવજીભાઈ, LR જીતુભાઈ રાજશીભાઈ, તથા LR મયુરભાઈ લક્ષ્મણભાઈનાઓએ સઘન તપાસ કરી પેટ્રોલીંગ કરી આ ગુન્હાના આરોપી ભાવેશ ઉર્ફે ટારજન પ્રવીણભાઈ ટોડરમલ રહે.ખારવાવાડ પોરબંદર વાળાને સદર ગુન્હાનાં મુદામાલનાં ચાંદીનાં મુંગટ કી.રૂ.૩,૫૦૦/-નું પોકેટકોપ તથા ઈ-ગુજકોપનાં માધ્યમથી તપાસ કરતા મજકુર ઈસમ અગાઉ પણ મંદિર ચોરીનાં એક ગુન્હામાં મારામારીનાં ચાર ગુન્હામાં તથા પ્રોહીબીશનમાં ત્રણ ગુન્હામાં સંડલવાયેલ હોવાની માહિતી મળતા મજકુર ચોર ઈસમને નામદાર કોર્ટમાં રજુ કરી વધુ રીમાન્ડની માંગણી કરેલ છે.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) તા.૧૮/૧૦/૨૦૨૧ થી તા.૨૪/૧૦/૨૦૨૧ સુધી કમલાબાગ પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ ૭૦ માસ્કનું વિતરણ કરવામાં આવેલ. લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનું પાલન કરવા અને કોવીડ-૧૯ બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

(૨) તા.૧૮/૧૦/૨૦૨૧ થી તા.૨૪/૧૦/૨૦૨૧ સુધી હાર્બર મરીન પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ ૪૮ માસ્કનું વિતરણ કરવામાં આવેલ. લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનું પાલન કરવા અને કોવીડ-૧૯ બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

(૩) કીર્તિમંદિર પો.સ્ટે. વિસ્તાર માંથી તા.૨૪/૧૦/૨૦૨૧ ના રોજ સાંજનાં આશરે ૬ વાગ્યે એક રીક્ષા ચાલકને ઠક્કર પ્લોટ SBI બેંક પાસેથી આશરે ૨ વર્ષ ની બાળકી તમન્નાબેન મોહમદભાઈ ગુલામ રહે. ઠક્કરપ્લોટ, તકીયા પાસે, પોરબંદર મળી આવતા કીર્તિમંદિર પોલીસ સ્ટાફ દ્વારા બાળકીને સાથે રાખી તપાસ કરતા, મળી આવેલ બાળકી ઠક્કર પ્લોટમાં રહેતા મોહમદ યાસીનભાઈ ગુલામની હોય, જેથી બાળકીનાં માતા-પીતાને પોલીસ સ્ટેશન બોલાવી બાળકી સોંપી આપેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર